



GANESH BENZOPLAST LIMITED

CIN: L24200MH1986PLC039836

Regd. Office: Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines, Mumbai - 400 002

Tel: 022- 6140 6000/22001928

Email: compliance@gblinfra.com Website: www.ganeshbenzoplast.com

August 12, 2025

To,

The General Manager, Department of Corporate Services – Corporate Relations Department, BSE Limited, Pheeroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai – 400 001. Scrip ID: 500153	The Manager, Listing Department National Stock Exchange of India Limited Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G-Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai – 400051 Scrip ID: GANESHBE
---	---

Dear Sir/Madam,

Sub: Intimation of Publication of Un-Audited Financial Results in Newspapers

Pursuant to Regulation 33, 47 and other applicable Regulations of SEBI (LODR) Regulations, 2015, the Un-Audited Financial Results (Standalone and Consolidated) for the quarter ended June 30, 2025 was duly published in the following newspapers:

The Business Standard, Mumbai Lakshadweep & Mumbai Samachar on dated August 12, 2025.

The extracts of the newspapers are enclosed for your reference.

You are requested to take the above information on records and oblige.

Thanking You,

Yours sincerely,
For Ganesh Benzoplast Limited

Ekta Dhanda
Company Secretary & Compliance Officer

Encl: As above



I G PETROCHEMICALS LIMITED

CIN: L51496GA1988PLC000915
Regd. Office: T-10, 3rd Floor, Jairam Complex, Mala, Neugi Nagar, Panaji, Goa - 403 001.
Tel: 0832-2970973 Email: igpl@igpetro.com Website: www.igpetro.com

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025

The Board of Directors of the Company, at their meeting held today, have approved the standalone and consolidated unaudited financial results of the Company for the quarter ended 30th June, 2025.

The financial results of the Company along with the Limited Review Report are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and are posted on the Company's website at <https://www.igpetro.com/quarterlyresults1/> which can be accessed by scanning the Quick Response code.



By order of the Board
For I G Petrochemicals Limited

Nikunj Dhanuka
Chairman & Managing Director
DIN 00193499

Place : Mumbai
Date : 11th August, 2025



PROFECTUS CAPITAL PRIVATE LIMITED

Registered and Corporate Office address: B/17, 4th Floor, Art Guild House, Behind Phoenix Marketcity Mall, Lal Bahadur Shastri Marg, Kurla (West), Mumbai, 400070.

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES [UNDER RULE 8(6)]

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSET CHARGED TO THE BANK UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 ("SARFAESI ACT") READ WITH RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 ("RULES") Notice is hereby given to the public in general and in particular to the Borrower, Guarantor (s) and Mortgageor (s) that the below described immovable properties mortgaged/charged (collectively referred as "Property") to Profectus Capital Pvt Ltd. ("Secured Creditor/NBFC"), the possession of which has been taken by the Authorised Officer of the Secured Creditor under section 13(4) of the SARFAESI Act read with the Rules, as detailed hereunder, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "Without Recourse Basis" on Date, for recovery of Rs. 1.08.57,520.00/- (Rupees One Crore Eight Lakhs Fifty Seven Thousand Five Hundred and Twenty Only) outstanding as on 14.10.2022 due to the Profectus Capital Pvt Ltd., (Secured Creditor) along with all outstanding dues (interest and charges) as on the date of Auction, due to the Profectus under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules, 2002 from the Borrower mentioned below by inviting bids as per below e-auction schedule

BRIEF DESCRIPTION OF PARTIES, OUTSTANDING DUES AND PROPERTY DETAILS					
Name of the Borrower	Last Date for Receipt of Bids along with document(s)	Property inspection Date & Time	Reserve Price & Earnest Money Deposit	Date, Time & Venue of Auction	Authorised Officer Name & Contact No
1. Hotel Om Sairam (Prop. Bharat Mangaldas Patil) 2. Bharat Mangaldas Patil 3. Manjula Mangaldas Patil 4. Mangaldas Kalaram Patil	30.08.2025	25th August 2025 to 28th August, 2025 Between 11:00 AM to 5:00 PM	RP: Rs. 95, 00,000/- EMD: Rs.9,50,000/-	1st Sept, 2025 at 11:00 AM to 05.00 PM The E-Auction Sale will be conducted through online portal: https://sarfaesi.auctiontiger.net	Mr. Mangesh Patil; +91 8082054151. Mr. Avadhut Nalge; +91 9322293315

Property Description: All that piece and parcel of Land along with structure standing thereon, admg. 500 sq. mtrs. bearing Survey No. 30, Hissa No. Part, situated at Village Bhoirgaon, Kukase, Taluka Bhiwandi & Dist. Thane 421302.

For detailed terms and conditions of sale, please visit below link: <https://www.profectuscapital.com/public-notices/>
Interested bidders may avail support for E-Auction from M/s e-Procurement Technologies Pvt. Ltd. (Auctiontiger) Support Help Desk No. 9265562818 / 9265562821 / 079-6813 6842. Contact Person Mr. Ram Sharma, Mob No. 8000023297.

Date:12.08.2025
Place: Mumbai

Sd/-
Authorised officer
For Profectus Capital Pvt. Ltd.



Dhunseri Tea & Industries Limited

Registered Office: "Dhunseri House", 4A, Woodburn Park, Kolkata-700 020
CIN: L15500WB1997PLC085661; Phone: +91 33 2280 1950 (Five Lines); Fax: +91 33 2287 8350 / 9274
E-mail: mail@dhunseritea.com, Website: www.dhunseritea.com

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2025

(Rupees in lakhs)

Sl. No.	Particulars	STANDALONE				CONSOLIDATED			
		Three months ended 30/06/2025	Preceding Three months ended 31/03/2025	Corresponding Three months ended 30/06/2024	Year Ended 31/03/2025	Three months ended 30/06/2025	Preceding Three months ended 31/03/2025	Corresponding Three months ended 30/06/2024	Year Ended 31/03/2025
1.	Total Income from Operations	7,317.77	2,987.17	7,186.14	33,142.81	11,650.50	7,193.23	9,867.45	46,219.33
2.	Net Profit/(Loss) for the period before tax and exceptional items	1,125.70	(5,296.20)	527.39	(2,625.65)	1,601.47	(6,725.91)	(291.93)	(5,667.74)
3.	Net Profit/(Loss) for the period before tax and after exceptional items	1,125.70	(4,141.38)	527.39	103.17	1,601.47	(5,571.09)	(291.93)	(2,938.92)
4.	Net Profit/(Loss) for the period after tax and after exceptional items	978.29	(3,434.62)	408.01	232.48	1,435.41	(4,212.41)	(295.15)	(2,004.64)
5.	Total Comprehensive Income for the period [(Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income(after tax)]	1,111.82	(3,775.21)	580.86	236.82	1,556.33	(4,488.01)	(183.93)	(2,035.37)
6.	Equity Share Capital	1,050.74	1,050.74	1,050.74	1,050.74	1,050.74	1,050.74	1,050.74	1,050.74
7.	Other Equity				52,681.57				50,950.39
8.	Earnings per Share (Face Value Rs 10/- per share) - Basic and Diluted (Rs.)	9.31*	(32.69)*	3.88*	2.21	13.66*	(40.09)*	(2.80)*	(19.08)

* Not Annualised

Note : The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter ended June 30, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended June 30, 2025 are available on the Stock Exchange websites www.nseindia.com and www.bseindia.com) and also on the Company's website www.dhunseritea.com. The same can also be accessed by scanning the QR Code provided below:



Scan the QR code to view the Results

For and on behalf of the Board
C. K. Dhanuka
Chairman & Managing Director
DIN : 00005684

Place: Kolkata
Date: 11th August, 2025



GANESH BENZOPLAST LIMITED

Regd. Office : Dina Building, 1st Floor, 53, Maharashtra Karve Road, Marine Lines (East), Mumbai 400 002.
CIN : L24200MH1986PLC039836 Telefax No. : +91 (22) 22001928 / 61406000
e-mail : investors@gblinfoa.com web-site : www.ganeshbenzoplast.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

₹ in Millions (Except EPS)

Sr. No.	Particulars	STANDALONE				CONSOLIDATED			
		Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Corresponding three months ended in the previous year June 30, 2024	Year Ended March 31, 2025	Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Corresponding three months ended in the previous year June 30, 2024	Year Ended March 31, 2025
		UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED
1	Total Income From Operations	569.54	575.57	484.83	2,154.01	956.18	999.34	875.25	3,743.11
2	Net Profit for the period (before tax and exceptional items)	206.47	243.50	208.65	861.92	262.57	285.85	219.92	966.53
3	Net Profit for the period (before tax and after exceptional items)	196.93	(200.28)	208.65	418.14	253.03	(161.46)	219.92	519.22
4	Net Profit for the period (after tax and exceptional items)	140.91	(158.58)	157.40	307.25	181.33	(131.92)	164.30	380.86
5	Total Comprehensive Income for the period	142.51	(158.13)	156.15	300.61	182.87	(131.79)	165.74	373.97
6	Equity Share Capital (Face value of Re. 1/- each)	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99
7	Other Equity as shown in the audited balance sheet of the previous year				5,223.41				5,311.39
8	Earning Per Share (of Re. 1/- each) (not annualised) (after exceptional items)								
a)	Basic	2.06	(2.20)	2.19	4.27	2.52	(1.83)	2.28	5.29
b)	Diluted	2.06	(2.20)	2.19	4.27	2.52	(1.83)	2.28	5.29

Notes:

- The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended on June 30, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the un-Audited Financial Results are available on the Company's website , www.ganeshbenzoplast.com and and Stock Exchanges website. www.bseindia.com and www.nseindia.com .
- The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 11th August, 2025.



By Order of the Board
Ganesh Benzoplast Limited
Sd/-
(Rishi Pilani)
Chairman & Managing Director
(DIN 00901627)

Place : Mumbai
Date : August 11, 2025

PUBLIC NOTICE

Notice is hereby given to the public that as per instructions from my client, I am investigating the title of (1) Mr. Bhupinder Kumar Rajkumar Grang, (2) Mr. Narinder Kumar Rajkumar Grang, (3) Mr. Ajay Bhupinder Kumar Grang, and (4) Mr. Kunal Narinder Kumar Grang, all residents of Wadala (West), Mumbai - 400031 ("Owners"), to the property described in the Schedule hereunder written ("said Property") and my client is desirous of purchasing the said Property from the Owners ("Proposed Transaction"). Any person having any claim, demand, share, right, title or interest in respect of the said Property or part thereof by way of sale, agreement for sale, allotment, transfer, assignment, exchange, mortgage (including by way of deposit of original title deeds and/or otherwise), lien, charge, gift, trust, inheritance, possession, occupation, tenancy, sub-tenancy, lease, sub-lease, license, care-taker basis, trust, maintenance, easement, acquisition, requisition, any encumbrance or beneficial right/interest under any trust, right of prescription or pre-emption or under any agreement or other disposition or under any suit, decree, injunction order or attachment or award passed by any Court or Authority, litigation, lis-pendens, decree or order of any adjudicating authority, partition, power of attorney, will, bequest, family arrangement/ settlement, or otherwise howsoever ("Claim"), is hereby requested to make the same known in writing together with copies of supporting documentary evidence to the undersigned at Flat No. 502, 5th Floor, A Wing, Cosmos Nest, Dhokali Naka, Kolshet Road, Thane (West) - 400607 within 14 (fourteen) days from the date hereof, failing which, it shall be presumed that no such Claim exists or that any such claims or objections, if any, will be considered to have been waived and/or abandoned and my client will complete the Proposed Transaction for the said Property with the Owners.

SCHEDULE REFERRED TO HEREINABOVE

(Description of the said Property)

ALL THAT premises being Shop No. 4 admeasuring about 35.90 square meters built up area along with loft area admeasuring about 31.10 square meters built up area, in aggregate about 67.00 square meters built up area, on the Ground Floor of the building known as "Vallabh Darshan", situate, lying and being at 102/104, Sheriff Devji Street, 43 and 43/A (Dhobi Street), CS No. 460 of Mandvi Division, Mumbai - 400003 and 20 (twenty) shares of Rs.50/- each bearing distinctive nos. 1 to 20 (both inclusive) under Share Certificate No. 1 dated 16th November 2020 issued by Vallabh Darshan Tenants Premises Co-operative Society Limited (bearing registration no. MUM/ W(B) HSG/ TC/8762/2015-2016), having its registered address at 102/104, Sheriff Devji Street, 43 and 43/A (Dhobi Street), CS No. 460 of Mandvi Division, Mumbai - 400003. Dated: 12th August, 2025.

Sd/-
Yusuf A Indorewala
Advocate, High Court of Bombay

PUBLIC NOTICE

Notice is hereby given by my client that , his Original Allotment letter issued by society in favour of Shri Gerelo V Bangera, dated 27th June, 1996 , in regards for the said Flat No 201, 2nd Floor , B wing, Charkop Hemavathi Chsl, plot no 9, RDP - 7, Sector 7, Charkop , Kandivali (West) Mumbai -400067 in the name of Sunil Bholanath Baug has been lost/ misplaced /not traceable and for the same my client have lodged online police complaint. Dated 08/08/2025 vide Lost report no -103478/2025, with Charkop Police station. It is hereby notified to all that unless any objection/claim is received within fifteen (15) days from the publication of this notice , in respect of a b o v e - m e n t i o n e d l o s t Documents, he/she/they shall submit along with the Documentary evidence in b e l o w m e n t i o n e d A d v o c a t e s address, after the expiry of 15 days No claim shall be entertained.

Sd/-
Date : 12.08.2025 ADV. SHARMILA PAWAR
Place : Mumbai (Advocate High Court)
Mahi Bungalow, Plot No.22/12, Sector-V, Charkop, Kandivali (W), Mumbai-400067. Mobile No.9930923876

IN THE COURT OF THE VIII ADDL CITY CIVIL & SESSIONS JUDGE AT BENGALURU O.S No. 6163/2024 (CCH-15)

BETWEEN: SHRI. T VENKATESH MURTHY, S/o Thammaiah, Aged about 57 years, R/o No.246, 2nd Main Road, 2nd Cross, New Binnypete layout, Binnypete, Magadi Road, Bangalore-560023 & OTHERS .. PLAINTIFFS

AND: SHRI. G DAYANANDA SWAMY & OTHERS .. DEFENDANTS

NOTICE TO DEFENDANT No.6

AFFION IMPEX Private Limited, Dr. DB marg, Plot No. 418, Ravet Building No.2 Office No.8 Mumbai City, Maharashtra-400004. Also at No.7 Floor 1, Plot 264 Ratan House Raja Ram Mohan Roy Marg, Central Plaza Cinema Charani Road, Gurgaon, Mumbai, Maharashtra India - 400004. Represented By its Directors ARPIT CHAJER and VISHAL MARU

Whereas the above named Plaintiffs have initiated the above said suit to this court under Order VII Rule 1 R/w Section 26 of CPC 1908 for Mandatory Injunction and Declaration that registered Sale agreement dated 09-11-2021 bearing number BSK-1-07395-2021-22 executed by the Defendant No.1 and Defendant no.2 in favor of the Defendant No.6 is non-est, null and void in respect of the SUIT SCHEDULE A PROPERTY. And Declaration that registered Sale Deed, dated 07-05-2018 bearing number 1037/2018-19 executed by the Defendant No.1 and Defendant no.2 in favor of the Defendant No.4 & 5 is illegal, void, ineffective and-not binding on them in respect of SUIT SCHEDULE B PROPERTY. You are hereby summoned to appear before this court on 12-09-2025 at 11:00 A.M in person or through Advocate / pleader to answer the question put in the summons which suit will be heard and determined as ex-parte.

SUIT A SCHEDULE PROPERTY

All that piece and parcel of land in Sy.No.53/1B Totally measuring 1 acres 32.22 guntas (7509 square meters) Situated at VASANTHAPURA Village, Uttarahalli hobli, Bangalore South Taluk, And Bounded as follows: East by: Road, West by: Sy.No: 54, North by: Sy.No.54 and Sy.No.53/1A, South by: Sy.No.53/1B.

SUIT 'B' SCHEDULE PROPERTY

All that piece and parcel of land in Sy.No.53/1A, Situated at VASANTHAPURA Village, Uttarahalli hobli, Bangalore South Taluk, And Bounded as follows: Totally measuring, 0 acres 25.85 (Twenty Five point Eight Five Guntas) and the property is bounded on the: East by: Property No. 44/1 & 44/2, West by: Sy.No: 54, North by: remaining land in Sy.No.53/1 A, South by: Sy.No.53/1B.

Given under my hand and the seal of this court on 06-08-2025.

By order of the court, Senior Sheristadar, City civil Court at Bangalore.

ASM LAW PARTNERS,
Advocates & Solicitors
No.94/1-2, 1st Floor, Infantry Road, Bengaluru-560001.

PUBLIC NOTICE

This is to notify that, Government of India (MoEF&CC), Regional Office, Nagpur vide letter No. Online Proposal No. FPM/H/ROAD/47972/2024, dated 01/10/2024 and vide letter No. Online Proposal No. FPM/H/ROAD/47972/2024, dated 06/01/2025 has granted In-principle Approval and Final Approval respectively, under the Forest (Sanrakshan Evam Samvardhan) Adhiniyam, 1980 for Diversion of 0.0236 Ha. (Zero Point Zero Two Three Six Hectares) Protected Forest land for construction of approach road, including water pipeline, Electrical line, Drainage line and any other utility services etc., along the road for private land Gut No. 168 of Village Mappaon, Tal. Alibag, Dist. Raigad in the State of Maharashtra in favour Smt. Anupa Tanna Shah, who is the owner of the land and Shri. Manish Surji Chhedra, Authorized Signatory and Project Authority on her behalf.

Further, Government of Maharashtra (Forest Department), Chief Conservator of Forest (T.), Thane Forest Circle, Thane vide Order No. Desk-10/FC/CR.59/24-25/1/2025-26, Dated 23/05/2025 granted Working Permission for Diversion of 0.0236 Ha. Protected Forest land of Old Survey No. 96/1/1 of Village Mappaon, Tal. Alibag, Dist. Raigad for construction of approach road, including water pipeline, Electrical line, Drainage line and any other utility services etc., along the road for private land Gut No. 168 of Village Mappaon, Tal. Alibag, Dist. Raigad in the State of Maharashtra. This permission is granted subject to fulfillment of the following terms/conditions.

- The said permission is limited to work in the proposed diversion area under the project and the said permission is for One year only i.e. valid till dt. 23.05.2026. This means that the said permission shall be deemed automatically cancelled from 24.06.2026. Within one year of the issuance of the said permission, the project authority is required to fulfill all the terms and conditions of the Central Government's in-principle and final approval letter and obtain a diversion order from the State Government. Since it is not within the power of this office to extend the said permission, the project authority cannot correspond with this office to continue the work in the proposed area after the expiry of the one-year period.
- As per Condition No. 1.3 of the Central Government In-Principle Approval Letter, the Project Authority has paid an amount of Rs. 2,54,025/- to the CAMPA Authority on 05.11.2024 for the plantation and maintenance of 100 trees.
- As per Condition No. 1.4 of the Central Government In-Principle Approval Letter, the Project Authority has paid an amount of Rs. 26,359/- to the CAMPA Authority on 05.11.2024 for the Net Present Value.
- As per Condition No. 1.8 of the Central Government letter, Certificate under the Forest Rights Act, 2006, Dated 03.04.2025 from the District Collector-Raigad has been submitted by the Project Authority. If lease holders/eligible plot holders etc. are found within the forest area under the proposal, the Project Authority shall be responsible for providing rehabilitation/compensation as per the rules. The Project Authority has submitted an undertaking in this regard.
- As per Condition No. 1.11 of the Central Government In-Principle Approval Letter, the Project Authority has mentioned obtaining environmental clearance, if required for the said project. The Project Authority has submitted an undertaking in this regard.
- Before starting work in the proposed area, the Project Authority must inform the Deputy Conservator of Forests, Alibag. The Deputy Conservator of Forests, Alibag, will check whether there is any violation in the proposed forest land during the work. If violation is found, action will be taken as per paragraph No. 1.21 of the Handbook issued by the Ministry of Environment, Forest and Climate Change, Government of India, New Delhi.
- If any measures are suggested to ensure that the habitat of birds / Wildlife in the project area is not destroyed due to the project, the Project Authority shall take the necessary measures.
- It is necessary to ensure that forest resources are not damaged while carrying out works by the Project Authority in the forest area under the project.
- For the Condition No. 1.1, 1.2, 1.5, 1.6, 1.7, 1.9, 1.10, 1.12, 1.13, 1.14, 1.16, 1.17, 1.18, 1.19 and 1.20 of the Central Government In-Principle Approval Letter, the Deputy Conservator of Forests, Alibag will be responsible for ensuring that the issues in the undertaking submitted by the Project Authority are fulfilled within the prescribed period. In case of non-compliance with any of the above conditions, the Deputy Conservator of Forests, Alibag will submit a report as per paragraph 1.21 of the Handbook issued by the Ministry of Environment, Forest and Climate Change, Government of India, New Delhi under the Forest (Sanrakshan Evam Samvardhan) Adhiniyam, 1980.

The details of the said land are as follows:

SCHEDULE					
S. No.	Taluka	Village	Old Sr. No.	Forest area in Ha.	Type of Forest
1.	Alibag	Mappaon	96/1/1	0.0236	Protected Forest

The above-mentioned in-principle approval and final approval letters are available on the Government of India website www.parivesh.nic.in and the orders of the Government of Maharashtra, Forest Department are available on the website www.mahaforest.gov.in.

Dated - 11/08/2025
Place - Mumbai

Sd/-
Mr. Manish Surji Chhedra
Authorised Signatory & Project Authority
for Mrs. Anupa Tanna Shah
Office: 3rd Floor, Devidas Mansion, Mereweather Road, Colaba, Mumbai - 400 001.

कार्यपालक अभियन्ता का कार्यालय

ग्रामीण कार्य विभाग, कार्य प्रमण्डल, कोडरमा

शुद्धि - पत्र

इस कार्यालय के ज्ञापक-645, दिनांक-07.08.2025 द्वारा मुख्यमंत्री ग्राम सड़क योजना अन्तर्गत आमंत्रित अत्यकालीन ई-पुर्निविदा आमंत्रण सूचना संख्या-05(RI)/2025-26/RWD/EE/KODERMA, दिनांक-07.08.2025, PR-359202 Rural Work Department(2025-26) से प्रकाशित निविदा को अपरिहार्य कारणवश रद्द किया जाता है।

हो / -
कार्यपालक अभियन्ता,
PR 359312 Rural Work ग्रामीण कार्य विभाग, कार्य प्रमण्डल, Department(25-26)#D कोडरमा

Public Notice

TO WHOMSOEVER IT MAY CONCERN

This is to inform the General Public that following share certificate of Aegis Logistics Ltd, having its Registered Office at 502, Skylon GIDC, 5th Floor, Char Rasta, Valsad, Vapi, Gujarat, 396195 registered in the name of the following Shareholder/s have been lost by them.

Sr. No.	Name of the Shareholder/s	Folio No.	Certificate No./s	Distinctive Number/s	No. of Shares
1.	KANTABHATT	K41039	3846	5805321 to 5808650	3330
2.	SADHANABHATT				

The Public are hereby cautioned against purchasing or dealing in any way with the above reference share certificates.

Any person who has any claim in respect of the said share certificate/s should lodge such claim with Company or its Registrar and Transfer Agents MUGF Intime India Private Limited, C101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (W), Mumbai-400083, Maharashtra TEL: +918108116767 within 15 days of publication of this notice after which no claim will be entertained and the Company shall proceed to issue Duplicate Share Certificate/s.

Place: Mumbai
Date: 12/08/2025

SADHANA GIRISH DESAI
Name of the Registered Shareholder

PUBLIC NOTICE

Notice is given on behalf Mr. Dipesh Harish Visawadia and Mrs. Nikita Dipesh Visawadia, in respect of the property, more particularly described in the SCHEDULE, hereunder which they have decided to purchase from Ms. Bharati B. Dicholkar. The said property was originally owned by Mrs. K. B. Dicholkar. The said Mrs. K. B. Dicholkar died on 16/01/2002 and the said property was inherited by her daughter and only surviving legal heir Ms. Bharati B. Dicholkar. The Society has transferred the said scheduled property to the name of Ms. Bharati B. Dicholkar, after following due process and diligence as laid down in the Bye laws of the Society.

Therefore, any person(s) having any claim in respect of the said scheduled property or part thereof by way of sale, exchange, mortgage, charge, gift, maintenance, inheritance, possession, lease, tenancy, sub-tenancy, lien, license, hypothecation, transfer of title, or beneficial interest under any trust, right of prescription or pre-emption or under any agreement or disposition or under any decree, order or award or otherwise claiming, howsoever, are hereby requested to make the same known in writing together with supporting documents to the undersigned at their office at 37/38, 3rd Floor, Landmark Tower, Link Road, Mithichowki, Malad (West), Mumbai- 400 064, within a period of 14 days (both days inclusive) of the publication hereof failing which the claim of such person(s) will be deemed to have been waived and/or abandoned.

SCHEDULE

Flat No.9, admeasuring 505 sq. ft carpet area on the second Floor, of the building known as "Gurukripa" of New Liberty Co-op. Hsg. Society Ltd., Liberty Garden Road No.4, Malad West, Mumbai 400064, situate on C. T. S. Nos. 405, 405/1 to 8, Village Malad South, Taluka Borivali, Mumbai Suburban District.

Date : 12.08.2025
Place : Mumbai

Nishant Rana
Advocate High Court

FORM NO. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Act [Pursuant to section 374(b) of the companies Act, 2013 and rule 4(1) of the companies (Authorized to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to the Registrar at Registrar of Companies that **CHEMBUR CENTER OF PEDIATRICS LLP**, a LLP may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.

2. The principal objects of the company are as follows:
To conduct business of healthcare services, pediatric center, hospitals and other medical related services.

3. A copy of the draft memorandum and articles of association of the proposed company can be inspected at the office at **PLOT NO. 425, 1ST FLOOR, 10TH ROAD, CTS NO.1273A, NEAR SANDHU GARDEN, CHEMBUR, MUMBAI- 400071, MAHARASHTRA, INDIA.**

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Registrar of Companies Mumbai, at 100, Everest, Marine Drive, Mumbai, Maharashtra 400002 or Registrar of Companies CRC at Plot No. 6, 7, 8, Sector 5, IMT Manesar, Gurgaon, Haryana, 122050. within twenty one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Name(s) of Applicant
1. KAVITA KANTILAL GOHIL 2. CHAITALI ATISH LADDAD
3. ROHIT EKNATH NARVEKAR

Place: Mumbai
Date: 12.08.2025



NANDURBAR BRANCH

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property)

Whereas :

The undersigned being the Authorized Officer of the Canara Bank under Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a **Demand Notice dated 30-05-2025** calling upon the **Borrower M/S JAY DURGA CEMENT PIPE COMPANY (Borrower), SHRI RAMAKANT RAMDEV MISHRA (Proprietor) and SHRI RAMAKANT RAMDEV MISHRA (Mortgagor)** to repay the amount mentioned in the notice, being **Rs.39,79,338.00 (Rupees Thirty Nine Lakh Seventy Nine Thousand Three Hundred Thirty Eight Only)** within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this **08th day of August of the year 2025.**

The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will subject to the charge of Canara Bank for a total amount of **Rs.40,53,385.42 (Rupees Forty Lakh Fifty Three Thousand Three Hundred Eighty Five and Paise Forty Two Only)** plus interest thereon.

The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property
All that part and parcel of Lease Hold Industrial N.A. Plot No A-13, Area 1740 Sq Mtr. Area Of Constructed Property 363 Sq Mtr. Situated At Peth Peinth Industrial Area Village Peth District Nashik Maharashtra 422208. **Owned By:** M/S Jay Durga Cement Pipe Company Proprietor: Shri Ramakant Ramdev Mishra **Cursal Asset Id: 400082323215 Bounded: On the North by:** Plot No A-18 & A-19 **On the South by:** Easement Pathway & the Plot No 44 & 15.00 mt wide MIDC Road **On the East by:** Plot No A-14 **On the West by:** Easement Pathway & then MIDC Boundary

DATE : 08/08/2025
PLACE : Nandurbar Branch

Sd/-
Authorized Officer, Canara Bank

ही राजकीय नाही, संविधान वाचवण्याची लढाई-राहुल गांधी

नवी दिल्ली, दि. ११: बिहारमधील मतदार यादीच्या विशेष सघन सुधारणा कॅम्पेस एसआय आणि निवडणुकीत महत्त्व 'मत चोरी' विरोधात इंडिया आघाडीच्या नेत्यांनी संसद भवनापासून निवडणूक आयोगाच्या मुख्यालयापर्यंत मोर्चा काढण्याचा प्रयत्न केला. या दरम्यान त्यांना दिल्ली पोलिसांनी ताब्यात घेतले. सोशल मीडिया प्लॅटफॉर्म एक्सवर शेअर केलेल्या व्हिडिओमध्ये काँग्रेस नेते राहुल गांधी यांनी या निषेधाने वर्णन केवळ राजकीय आहे नाही तर संविधान वाचवण्याची लढाई असल्याचे म्हटले आहे.

२३ सेकंदांच्या या व्हिडिओमध्ये राहुल गांधी पोलीस स्टेशनमध्ये बसलेले दिसत आहेत. व्हिडिओमध्ये त्यांनी म्हटले आहे की, सत्य हे आहे की आपण बोलू शकत नाही. सत्य देशासमोर आहे. ही लढाई राजकीय नाही. ही संविधान वाचवण्याची लढाई आहे. ही एका व्यक्ती, एका मताची लढाई आहे. त्यांनी आपल्या एक्स पोस्टमध्ये लिहिले आहे की, आज जेव्हा आपण निवडणूक आयोगाचे भेटणार होतो. तेव्हा भारतीय आघाडीच्या सर्व खासदारांना थांबवण्यात आले आणि ताब्यात घेण्यात आले. मतांची चोरीचे सत्य आता देशासमोर आहे. ही लढाई राजकीय नाही. ही लोकशाही, संविधान आणि 'एक व्यक्ती, एक मत' या अधिकाराचे रक्षण करण्यासाठीची लढाई आहे. एकजूट असलेला विरोधी पक्ष आणि देशातील प्रत्येक मतदार स्वच्छ मतदार यादीचा मागणी करतो आणि आम्हाला हा अधिकार कोणत्याही किंमतीत मिळेल.

या मोर्चात लोकसभेतील विरोधी पक्षनेते राहुल गांधी, काँग्रेसचे सरचिटणीस प्रियांका गांधी वाड्रा, समाजवादी पक्षाचे अध्यक्ष अखिलेश यादव, तृणमूल काँग्रेस, द्रमुक आणि अनेक विरोधी पक्षांचे वरिष्ठ नेते

सहभागी होते. सुमारे एक तास चाललेल्या या निदर्शनादरम्यान खासदारांनी 'मत चोरी थांबवा' आणि 'एसआयआर संपवा' अशा घोषणा दिल्या. अनेक नेत्यांनी पांढऱ्या रंगाच्या टोप्या घातल्या होत्या ज्यावर एसआयआर आणि मत चोरी लिहिलेले होते आणि त्यावर रेड क्रॉस चिन्ह लावले होते.

हा निषेध मोर्चा थांबवण्यासाठी पोलिसांनी संसद भवनापासून काही अंतरावर आरबीआय गेटजवळ आधीच बॅरिकेडिंग केले होते. खासदार बॅरिकेडिंगजवळ पोहोचताच त्यांना तिथेच थांबवण्यात आले. निषेध म्हणून अखिलेश यादव, आदित्य यादव आणि धर्मेंद्र यादव यांनी बॅरिकेड ओलांडून उडी मारली. घटनास्थळी मोठा पोलीस बंदोबस्त तैनात करण्यात आला आणि निषेध तीव्र होताच पोलिसांनी राहुल गांधी, प्रियंका गांधी, अखिलेश यांच्यासह अनेक विरोधी नेत्यांना ताब्यात घेतले. विरोधी नेत्यांनी आरोप केला की, एसआयआरच्या नावाखाली लाखो नावे वगळली जात आहेत आणि हे लोकशाहीच्या विरोधात आहे.

जाहीर नौटीस

सर्व संबंधितास कळविण्यात येते कि, सर्व ५०/११ क्षेत्र ०००.११० हे. आर. चौ. मी. व पोर खराब क्षेत्र ०००.२५ हे. आर. चौ. मी. एकूण क्षेत्र ०००.३५ हे. आर. चौ. मी. गाव मोजे कौलार खुर्चा ता वसई, जि पालघर जि मिळकत चौथ्यास जसी कळ्यास, लविना जडविन डिडोसा, नेरीसा केनेने अंडुडीसा, अशोक थामस डायस, सरिता रॉय फर्नांडीस यांच्या मालकी व कब्जेअहिलदाटी आर आमचे अग्रणील ऑर्नटीन थॅपनी करवाली व सेडी व कोटेम फर्नांडीस हे सदरची मिळकत जमीन मालकाकडून विकत घेणार आहेत. सदर

[illegible]

जॉहरी नोटिस

सर्व संबंधितांमध्ये कळविण्याचे येथे कि, रि. स. नं. ५२४/२०१७, क्षेत्र १५०/२०१७ चीमी आणि रि. स. नं. ५२६, क्षेत्र ६७७/०७, चीमी, या नोटीस मालकी, गाव/पठर, त्या तसे, ति पाचार (सदर मिळकत) हे मिळकत धारिता बाबुराव अधिकारी यांच्या मालकी व कब्जावित्वातिल होती. त्यांनी सदरची याचिका नं. ४४८/१९९७, दि. ०४/११/१९९७, नोटीसी क. ४४८/१९९७, दि. ०४/११/१९९७ प्रमाणे प्राप्तीबाबत नमाली उकर अयांकन करीत ३८३ केसी होती. दित्या बाबुराव अधिकारी हे दि १५/०९/२०१९ आणि त्यांच्या पत्नी श्रीमती शेजा दित्या अधिकारी हे ०३/०८/२०१९ रोजी मोठ जात होते. त्यांचा पत्नी सांगता प्रमल्ल विट्ठल (मूलगी) आणि समीर दित्या अधिकारी (मूलगी) असे सातवांस आहे. समीर दित्या अधिकारी यांनी सदर मिळकत तीथील त्यांचा अविभक्त हिस्सा हक्क सोडप दि ३१/०८/२०१५, नोटीसी क. ३२२/३१/२०१५, दि. ३१/०८/२०१५ प्रमाणे सांगता प्रमल्ल विट्ठल यांच्या सोडून दित्या आहे. सदर मिळकतीबाबत त्यांचा नातामागिक हक्क, हिसरसंबंध अधिकार, थिंकत तपासणी करण्यास सांगितले आहे.

त्यांचे या सदरनांत जे कोणीही इसमांचा विक्की, गणपत, बसिषप, दान, दात, भडोडो, वेरेंगे हाणपत, बाबुसा खोजा अशाप्रमाणे तो त्यांनी सदर जॉहरी नोटीस प्रकट झाल्यापासून कोणी दावेसाचे आहे तोही कागदपत्री प्रामुखायविल निमिशितित साधिकांमना न. एस. पी. कन्सलटंट, अतिता सोनीपरी सेंटर, हसी मजला, पोरा ऑफिस मयूर, ब्रह्म ९२२ (प), ४०१२०२, या पत्त्यावर कळवावा, निदेश हक्क मालकी व तो असल्याची साकदा दिलेला आहे. असे समजण्यात येईल याची कृपाय नोंद घ्यावी.

दि. ११.०६.२०२५

अशितालॉट अँड. पायस डिमेलो

जाहीर सूचना

येथे सूचना देण्यात येत आहे की, माझे अखील **न. मधुसूदन गोपालदास साळवी उर्फ शाहू**, हे फ्लॅट नं. ९८, ९९ मजला, श्री बुधलक्ष्मी को-ऑप. हौसिंग सोसायटी लिमिटेड, जन्ता नगर रोड, ऑफ रेवनांगर रोड, भाईंदर पश्चिम, ठाणे ४०१ १०१ या फ्लॅटचे मालक आणि सोसायटी सदस्य असून फ्लॅटचे नंबर बाबबचे मेमॉरॉल नं. एस. भाईंदर कंस्ट्रक्शन कंपनी (विदर्भ) प्राप्त ते घेऊन **सहकार्य गोपालदास साळवी उर्फ शाहू** यांचा दरम्यान झालेले मुळ विक्री करारनाम्या गहाण / हरवलेले आहेत.

म्हणून कोणीही सदर हरवलेल्या करारनाम्याचा आधारित कोणताही व्यवहार करू नये आणि जूज कोर्टात क्वेश्चन होऊन फ्लॅटवर दावा / आक्षेप असल्यास त्यांनी लेखी स्वरूपात खालील खासगीकर्ताजोडे १२०, निलम ऑफिस, पंचरत कॉम्प्लेक्स, १०१ फ्लॅट रोड, भाईंदर पश्चिम, ठाणे ४०१ १०१ येथे सदर सूचना प्रकाशना तारखेपेक्षा ४५ दिवसांत कळवावे अथवा त्यावर खर्च होणाऱ्या दावा / आक्षेप त्याग करीत आहेत म्हणून समजले जाईल.

एच. पी. मेहता ग्रॅण्ड असोसिएट्स
(वकील)

ठिकाण : भाईंदर दिनांक : १२.०८.२०२४

PUBLIC NOTICE

Notice is hereby given on behalf of my client **Sayed Ahmed Ahmed Qureshi** that **Mr. Sayed Ahmed Qureshi**, owner of Flat No. 204, 2nd Floor, Gaurav Manthan No. 2, Gaurav Manthan Co-operative Housing Ltd., Gaurav Sankalp, Mira Road (East), Thane District-401 017, expired on **11th November 2024** without any nomination in respect of the said property.

Mr. Sayed Ahmed Qureshi, Expired on 11th day of November 2024, After his demise, his legal heirs are **Ms. Naziya Sayed Ahmed Qureshi**, **Mr. Haneef Sayed Ahmed Qureshi**, **Mr. Qureshi and Junaid Sayed Ahmed Qureshi**, **Junaid Sayed Ahmed Qureshi** expired on dated **20th Jan 2025**, after that By virtue of a **Release Deed** executed by **Mr. Haneef Pandekar** and **Ms. Javeria Qureshi**, at Sub Registrar Office, Mira Road (East), No. 5236/2025, relinquishing their respective rights in the said property, **Ms. Naziya Sayed Ahmed Qureshi** has become the sole and exclusive owner of the said premises.

Any person(s) having any claim, right, title, interest or share in the said property, as mentioned property shall notify the undersigned in writing with supporting documents within **14 days** from the date of publication of this notice. Failing which, such claims, if any, shall be deemed to have been waived and dismissed. In respect of the said property shall proceed accordingly.

Sd/-
ADVOCATE A. K. M. KISHRA
Office : Shubh Bungal, A. K. Marg,
Opp. Bandra Court, Bandra (East)
Mumbai - 400051. Mob. 8454920758

PUBLIC NOTICE

TO WHOMSOEVER IT MAY CONCERN

I, as the legal representative of
SMT. MOGALAMMA V.O. BABU, residing at
Flat No. B-204, 2nd Floor, Dharaavi V.O. Co-op
Housing Ltd., Bearing Registration No. BOMW
G-NHSG/CT/8973/95-02 Of 1995, V.O.
Tower K Krishnan Menan Marg, Near Karm
School, Dharaavi, Mumbai 400017, State of
Name: Dharaavi V.O. Co-op Housing Ltd.
was the lawful owner of Flat No. B-204, 2nd Floor
Dharaavi V.O. Co-op Housing, V.O. Co-op
Tower K Krishnan Menan Marg, Near Karm
School, Dharaavi, Mumbai 400017, State of
my mother in law **BASAMMA ASHAPPA**
BODA alias **BASAMMA KISTAPPA BODA** alias
BASAMMA BODA expired on 12.05.2013, as
my husband **SHRI. BABU KRISHNA BODA**
expired on 04.02.2012, were leaving behind the
flat and the share have to be transfer to be
SMT. MOGALAMMA V.O BABU for that SMT.
MOGALAMMA V.O BABU has submitted all
necessary documents to the society, along with
her children's 1. **MRS. POOJA MALLIKARJUN**
2. **MR. KRISHNA S/O BABU BODA** AND
3. **JYOTI/D BODA**, are the only legal heirs who
have transferred, surrendered, and relinquished
their rights in the said Flat premises to my client
Any person/s having any claim or objection
concerning the said Flat premises are requested
to contact me or my client within 15 days from the
date of this publication. In the absence of any
claims, I will be presumed that no further claims
exist over the said Flat premises, nor the claims
SMT. MOGALAMMA V.O BABU Sd/-
A.DV. SHAMSHER SHAIKH
B.Com., LL.B. (Advocate High Court
207, 2nd Floor, Om Sai Kripa Bldg.
Above Amber Hotel, Opp. Bandra Court
A.K. Marg, Amba East, Mumbai - 400017
Mob: 8097124785

**बोईसर अपघातग्रस्त कुटुंबाला १३
लाखांची नुकसान भरपाई**

पालघर, दि. ११: बोईसर
- मुखरे येथील संजीवनी संजय
नरे यांचे पती कामावर असताना
झालेल्या अपघातात मृत्यू
झाल्याने त्यांच्या कुटुंबावर
आर्थिक संकट कोसळले.
कंपनीने नुकसानभरपाई

देण्यास नकार दिल्यामुळे
 न्यायासाठीची लढाई
 अधिक कठीण झाली
 होती. मात्र, शिवशक्ती
 सामाजिक संघटनेचे
 अध्यक्ष संजय पाटील
 यांच्या ठाम पाठपुराव्यामुळे
 अखेर १३ लाख रुपयांची
 नुकसानभरपाई मिळवण्यात
 यश आले.

जाहीर नोटीस
माझे अशील सौ. मालती शिवशंकर यादव यांना दिलेल्या माहितीवरून जाहीर नोटीस देत आहे की खाली नमूद असलेली निवासी मिळकत ही मूळ भाडेकरू

[illegible]

मिळकतीचा तपशील :-
सी-३/४, पार्कसाईट, म्युनिसिपल कॉलनी,
पार्कसाईट, विक्रोली (प.), मुंबई-४०००७९.
दिनांक : १२.०८.२०२५
ठिकाण : मुंबई
अनिल राजू विश्वकर्म
(वकील उच्च न्यायालय
१५/बी, विश्वास को. ऑप. हौ. सोसायटी लि
पटेल चौक, घाटकोपर पूर्व, मुंबई - ४०००७९)

PUBLIC NOTICE

MRS. MUNAKI SHIVMURTI SINGH a Member of PALATIAL HEIGHT CO-OPERATIVE HOUSING SOCIETY LTD. Having address at Flat No. A-508, 5th Floor of the society died on 02-12-2015 without making any will. The Society hereby informs claims or objections from the heirs or heirs or other claimant of claimants to the transfer of the share of the said shares and interest of the deceased member in the capital/property of the society within a period of 15 days from the publication of this notice. With copies of such documents and other proofs in support of his/her/their claims/objections for transfer of shares and interest if the deceased member in the capital/property of the society shall be dealt within the manner provided under the bye-laws of the society. A copy of the registered bye-laws of the society is available for inspection by the claimants/objectors with the Society Office between office hours Time 10:00 a.m. to 6:00 p.m. from the date of publication of the notice till the date of the publication of the notice till the date of expiry of its period.

For and on behalf of PALATIAL HEIGHTS Co-operative Housing Society Ltd.

Place : Mumbai	Sd/	
Date : 12/08/2025	Secretary	

PUBLIC NOTICE

Notice is hereby given to the public at large that under instructions of my client, I am investigating the title of Mr. Chetan Ratilal Thakkar & Ors in respect of the following property: Land bearing Survey No. 50, Hissa No. 2/A corresponding to CTS No. 351/A and admn. about 269.34 mtrs. at Eksar Road, Borivali West, Mumbai 400092 of village Borivali, Taluka Borivali, MSD together with the structure standing thereon.

Any person having any claim, right, title or interest of any nature whatsoever are hereby requested to make the same known in writing, together with supporting documents, to the undersigned at the address: 404, Gyan Nagar, L.T. Road, Borivali West, Mumbai 400092 within 30 days from the date of publication of this notice, otherwise it will be deemed that there are no claims and/or that the same are waived.

Sd/-
SHEEYAS K. VYAS
Advocate High Court
Date: 12/08/2025

Place: Mumbai

[illegible]

ई-मनदानाच्या माध्यमातून नव शक्यतेचे स्वरूप

समाधानातून दूरस्थ ई-मनदान प्रणाली (‘रिमोट ई-कोइटर’) तसेच एजीएस्टाटमन ई-मनदान प्रणालीच्या माध्यमातून सुचविते विविध विषयांवर सूचना द्याव्यात असेल. दूरस्थ ई-मनदानातसमवेत ई-मनदानकारिताचे विस्तृत निदेशां मिळतात. समाधानकारिताच्या एजीएस्टाटम सुचविते विविध असेल.

एसीएम व सेबीच्या लागू परिषदांच्या अनुदानालागत सरद सुचनां बंध भाषापरकाळ्या माहितीसाठी व लाभार्थी जाती करण्यात येत आहे.

समाधान केलीच्या आटीए वॉन पुढील पत्त्यावर संपर्क साधू शकतात :

सी बी मॅनज्मेंट सॉल्यूशंस (प्रा.) लिमिटेड
 रस्तोई कोर्ट, ५ वा मजला,
 २०, सर आर.एन. मुकुजी मार्ग,
 कोलकाता - ७०० ००१,
 त्रि. क्र. ०३३-२१२०६ २१००
 ईमेल : rbm@cbmsl.com वेबसाइट : <https://cbmsl.com>

नॅशनल स्टॅन्डर्ड इंडिया लिमिटेड करिता
 सध्या /
 निदेशा पर्यंत
 कंपनीत व अनुदान पर अधिकारी
 समाधानात क्र. : २१८२०३

जाहीर नोटीस

सर्व लोकांना ह्या नोटीसीने कळविण्यात येते की
दुकान नं. ए-५, तुळमजला, श्री सौतल को-
ऑपरेटिव्ह होसिंग सोसायटी लिमिटेड,
देवदंड नगर रोड, भाईदर प. जि. ठाणे -
४०११११, श्रीमती मधु के. अग्रवाल व श्री
केतन क्रिष्णा अग्रवाल, ह्यांच्या नावांनी होता.
परंतु श्रीमती मधु के. अग्रवाल, हे ता.
३०/०७/२०१४, रोजी मयत झालेले असून ह्यांच्या
वास्तविकी म्हणून श्री जितेश कुमार अग्रवाल
अग्रवाल व तनिष्ठा केवल अग्रवाल, ह्यांनी
सोसायटीला सदर दुकान व शेअर
सेटिंग्जकरीत ५०% हिस्सा आपल्या
नावांनी करण्यासाठी अर्ज केलेला आहे. तसेच
सदर दुकानासंबंधित असलेला मेसर्स श्रीपाल
बिल्डर्स व श्रीमती कांतालाल गिडवानी
ह्यांच्यामधे येणाऱ्या झालेला बिल्टरचा मुळ
करारनामा हरवलेला आहे.

तरी सदर दुकानावर कोणही व्यक्तीचा हक्क
असत तर त्यांनी ही नोटीस प्रसिद्ध झाल्यापासून
१४ दिवसांसाठी आपल्याजवळील
पुरव्यावळी शॉप नं. २, मेरीबाई वाम,
वालवड शॉपिंग सेंटरसमोर, एम. बी. एम.
सी. ऑफिस जवळ, स्टेशन रोड, भाईदर
(पश्चिम), जि. ठाणे - ४०११११, ह्या पत्त्यावर
लेखी कळवावे, अन्यथा तसा कुठल्याही
प्रकारचा हक्क हितसंबंध नाही असे समजून
सोसायटीला सदर अर्ज मंजूर करता येईल
ह्याची नोंद घ्यावी.

एडव्होकेट तवली आर. ज्योदन
(वकील, उच्च न्यायालय मुंबई)

दिनांक: १२.०८.२०२५

ठिकाण: भाईदर

प्राप्त्य संदर्भ मंडळानंतर कायानाही केल्याबद्दल
प्रकार हक्क नाही व तो अखत्यार संकेतून दिलेला
आहे असे समजण्यात येईल याची कृपया नोंद
घ्यावी.
ता. १०.०८.२०२५

अधिलाफिक अँड. पायस डितेल

PUBLIC NOTICE

Notice is hereby given that, Mr. Kishan
Naharsingh Rajput the joint owner of
Abhaynagar K Rajput of the Shop No. 20/
Uranus CHS Ltd., Thakur Village, Kandivli
Mumbai 400 101, expired on 15/07/2023.
Puran Singh Rathor, son of the deceased is
the share of the deceased in the property.

We hereby invite claims or objections from
or heirs or other claimant or claimants/obj
objects to the transfer of the said share
interest of the deceased member in the
property of the society within a period of 15
days from the publication of this notice with
of such documents and other proofs in sup
his/her claim/objections for transfer of
and interest of the deceased member in the
property of the society. If no claim/objection
received within the period prescribed abo
society shall be free to deal with the share
interest of the deceased member in the
property of the society in such manner as is p
under the bye laws of the society.

Dated on this 12th day of August 2025 at M

LEGAL REPRE
ADVOCATES, HIGH
OFFICE NO. 2, GROUND
SHANTI NIWAS CHS LTD, BLK
PATEL ESTATE, C.P. ROAD, KANDIVLI
MUMBAI

ता. वयस, जि. पालवर, अशा मी
श्री. उष्मान मोहम्मद मेथानी व २) श्री
उष्मान मेथानी हयांनी श्री. मदनर
हयांच्याकडून दिनांक - १८/०८/२००८
दत्त के. वयस-५६०/०१००, अ-
दिनांक २३/०८/२००८ गोजीया दूर
-२-५७३४-२००८ गोजीया चुकत
कारणाना अन्वये खरेजी केजी होती.
सहकारिता मेथानीला एक मालक
मोहम्मद मेथानी हे दि. ३१/०८/२००८
कोणवाही मुलुपुष्पा शिवाय सप्त झ
त्यांच्या मुलुपुष्पा (१) श्रीमती. न.स.
मेथानी (पत्नी), २) श्री. आझिउल उ
(मुलगा) व ३) श्री. उस्माना उर्र
(मुलगी). हे वारसा आहेत. अशा या
आधी, के. उष्मान मोहम्मद मेथानी
मुलुपुष्पाच्या त्यांच्या वारसा हक्काच्या द्या
नामाधिकार तपासत असता, मी न.स.
मंथंधाया तसेच वारसाहक्काच्या
कोणाहोईकडे हितसंबंधाच्या बाटणीने वि
दान, दावा, बक्षीसपत्र, भाडेपत्र
वगैरेशिवाय हितसंबंधाच्या वा हस्तान्तरणा
विधीबाधित ठरेल असा लेखी हक्कत
पुरावा संमत तर त्यांनी लेखी कायदे
पुरावासकच मद्रची नोंदीस परिषद
१४ दिवसांच्या अंत आम्हें कार्यालय
१ ला मजला, आसम फायसाल
नालासपोर, प. ता. वयस, जि. पालवर
हक्कत माग केलेली पाहिले.
काराचि हक्कत नाही व हक्कत हक्क
सोडून देण्यात आला आहे असे समज
अगदी निविदाव्य जोबाविरोधित
नामाधिकार द्यायला देण्यात येईल.
दिनांक १८/०८/२००८

पत्र वकील अहं
अ. देवन

EXTENDED CONSOLIDATED	
Sr. No.	Particulars
1	Total Income From Operations
2	Net Profit for the period (before tax and exceptional items)
3	Net Profit for the period (before tax and after exceptional items)
4	Net Profit for the period (after tax and exceptional items)
5	Total Comprehensive Income
6	Equity Share Capital (Face value of Re. 1/- each share)
7	Other Equity as shown in balance sheet of the period
8	Earning Per Share (of Rs. not annualised) (after tax and exceptional items)
a)	Basic
b)	Diluted

GANESH BENZOPLAST LIMITED

Office : Dina Building, 1st Floor, 53, Maharshi Karve Road, Marine Lines (East), Mumbai 400 002.
CIN : L24200MH1986PLC039836 **Telefax No. :** +91 (22) 22001928 / 61406000
e-mail : investors@gbllnfr.com **web-site :** www.ganeshbenzoplast.com

	STANDALONE				CONSOLIDATED			
	Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Corresponding three months ended in the previous year June 30, 2024	Year Ended March 31, 2025	Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Corresponding three months ended in the previous year June 30, 2024	Year Ended March 31, 2025
	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED
Revenues	569.54	575.57	484.83	2,154.01	956.18	999.34	875.25	3,743.11
Operating expenses (including Depreciation and amortisation)	206.47	243.50	208.65	861.92	262.57	285.85	219.92	966.53
Operating income (including Depreciation and amortisation)	196.93	(200.28)	208.65	418.14	253.03	(161.46)	219.92	519.22
Other income (including Depreciation and amortisation)	140.91	(158.58)	157.40	307.25	181.33	(131.92)	164.30	380.86
Profit before tax	142.51	(158.13)	156.15	300.61	182.87	(131.79)	165.74	373.97
Tax expense	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99
Profit after tax				5,223.41				5,311.39
Profit per share (₹)								
Basic	2.06	(2.20)	2.19	4.27	2.52	(1.83)	2.28	5.29
Diluted	2.06	(2.20)	2.19	4.27	2.52	(1.83)	2.28	5.29

नमुना क्र. आयतन-१९

सूचना

(कंपनी (स्थापना) अधिनियम २०१४ चे नियम २२ नुसार)

१. येथे सूचना देण्यात येते असे कि, कंपनी कायदा २०१३ च्या कलम (४) नुसार **लोकांसया वेलफेअर असोसिएट्स प्राय्व्हेट लिमिटेड** नावाचा प्रॉब्यक्टेड लिमिटेड असे अतिरिक्त शब्द जोडून आणि कंपनी कायदा २०१३ च्या कलम ८ प्रमाणे विवर्तित परवाना पत्र करणाऱ्या कंपनीचे आलेख, पश्चिम क्षेत्र वांछ्यांकडे अर्ज करण्यात आला आहे.

२. **कंपनीचे प्रमुख उद्दिष्ट** खालीलप्रमाणे: शेळीगण उपक्रम आणि इतर शेळीगणा सहाय्य उपक्रम

३. नियोजित कंपनीचे अहवाल व निवेदनिका पत्र **८४-ए, मिलत कोर्ट, २२२, नरीम पॉइंट, एएम, मुंबई-४००००१** येथे निर्धारणासाठी उपलब्ध आहेत.

४. जर कोणता व्यक्तीस, संस्थेत, कंपनी, गारमॅन्ट्स झाला म्हणजेही संस्था यांना सर जबाबीदार आढोप असल्यास त्यांनी त्यांचे आक्षेप **क्षेत्रिय संचालक, पश्चिम क्षेत्र** वांछ्यांकडे सदर सूचना प्राप्तानंतर तुरन्तच १५ दिवसांत **क्षेत्रिय संचालक, एम्प्लेट, एक मजला, १०० मीटर ड्राईव्ह, मुंबई-४००००१, महागाडी** क्षेत्र यांना पाठवावे पाडाववे आणि पत्रात अर्जासोबत सोयीची कागदास पत्र: **८४-ए, मिलत कोर्ट, २२२, नरीम पॉइंट, एएम, मुंबई-४००००१** येथे पाठावे.

अनुवादार्थे नाव

लोकांसया वेलफेअर असोसिएट्स प्राय्व्हेट लिमिटेड

जिगीटा जातव

आज दिनांकी १२ ऑगस्ट, २०२४

जाहीर सूचना

याद्रीये सायबना देण्यात येती की, आनंद शांणिसं संत प्रिमायसेस को-ऑपरेटिव्ह सोसायटी लिमिटेडचे अनुक्रमांक ६०१ ते ६०५ (दोन्ही सायबना) असलेले रु.५०/- प्रत्येकीचे पाच (५) पुणेणणे घराणें केल्ले शेअर्सकरिता भाग प्रमाणपत्र क्र.२०१ चे मुल भाग प्रमाणपत्र, सवय्य नोंद क्र.२०१ हे दिनांक २० ऑगस्ट, १९९७ रोजी प्रख्याति पत्र पत्रालाल शाह यांच्या नावे होतें ते पुढे मुकाबाने बी शाह आणी बसुभाई व्ही. शाह यांच्या नावे दिनांक २५.०८.१९९४ रोजी भाग प्रमाणपत्राच्या मागील वाक्य हस्तांतरित करण्यार आले होतें, ते हवले/गळख लाड आणे आणी त्यासंदर्भात दुय्य भाग प्रमाणपत्र वितरित करण्यारकरिताच आंद आनंद शांणिसं संत प्रिमायसेस को-ऑपरेटिव्ह सोसायटी लिमिटेड, गेशाला लेन, दस्तरी रोड, मालाड (पुर्व), मुंबई-४०००९५ चे सोसायटीकडे करण्यार आल आहे.


सोसायटी याद्रीये दुय्य भाग प्रमाणपत्र वितरित करण्यारकरिता दावेदार/आक्षेप घेणारे किंवा आक्षेप घेणारे यांच्या व्ही सूचना प्रकाशित झाल्येपसुन १५ दिवसांन आत त्यांच्या/ तिच्या दाव्यांच्या/आक्षेपांच्या समर्थनां अशा दत्तवावे सांच्या प्रती आणी इतर पुरावे मागवित आहे. सोसायटी प्रमाण पत्राले दावे/आक्षेप, अर असत नत, सोसायटीच्या उजिनमांतुय प्रार केल्ल्या पद्धतीने हाताळतले जातलें. या कालावधीत कोणतीही दावे/आक्षेप प्राप्त न झाल्यसो सोसायटी दुय्य भाग प्रमाणपत्र वितरित करण्यार मोकळी असलें.

च्या वतीने व करिता

आनंद शांणिसं संत प्रिमायसेस को-ऑपरेटिव्ह सोसायटी लिमिटेड

-सही/-
अध्यक्ष/सचिव

दिनांक: १२.०८.२०२१ दि. गणिका: मुंबई

	<div> <div>Register</div> <div>Extract of the</div> </div>
Sr. No.	
1	Total Income from Operations
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional/ Extraordinary)
3	Net Profit / (Loss) for the period (after Exceptional/ Extraordinary)
4	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period and other comprehensive income(after tax)]
5	Equity Share Capital (Face Value)
6	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet
7	Earning Per Share (of ₹ 10/-each)
Notes :	
1. The above is an extract of the Financial Statements (Disclosure Requirements) Registered with www.bseindia.com and on the website of the Institute of Cost Accountants of India.	
2. The above Financial Results are for the period ending August 2025.	
<div> <div>Place : Mumbai</div> <div>Dated : 11th August 2025</div> </div>	

[illegible]

GANESH BENZOPLAST LIMITED

Regd. Office: L-24 Building, 1st Floor, 53, Maharashtra Kharad Road, Marine Lines, Mumbai 400 002.

CIN: L24200MH1986PLC039836 **Telex No.:** + 91 (2) 22001928 / 61400600

e-mail: investors@gblinfra.com **web-site:** www.ganeshbenzoplast.com

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2025

₹ in Millions (Except EPS)

Sr. No.	Particulars	STANDALONE				CONSOLIDATED			
		Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Corresponding three months ended in the previous year June 30, 2024	Year Ended March 31, 2025	Quarter Ended June 30, 2025	Quarter Ended March 31, 2025	Corresponding three months ended in the previous year June 30, 2024	Year Ended March 31, 2025
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
1	Total Income from Operations	669.54	575.57	484.83	2,154.01	956.18	999.34	875.25	3,743.11
2	Net Profit for the period (before tax and exceptional items)	206.47	243.50	208.65	818.92	262.57	285.85	219.92	956.53
3	Net Profit for the period (before tax and after exceptional items)	196.93	(200.28)	208.65	461.14	253.03	(161.46)	219.92	519.22
4	Net Profit for the period (after tax and exceptional items)	140.91	(158.58)	157.40	307.25	181.33	(131.92)	164.30	380.86
5	Total Comprehensive Income for the period	142.51	(158.13)	156.15	300.61	182.87	(131.79)	165.74	373.97
6	Equity Share Capital (Face value of Re. 1/- each)	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99	71.99
7	Other Equity as shown in the audited balance sheet of the previous year				5,223.41				5,311.39
8	Earning Per Share (of Re. 1/- each) (Not annualised) (after exceptional items)								
a)	Basic	2.06	(2.20)	2.19	4.27	2.52	(1.83)	2.28	5.29
b)	Diluted	2.06	(2.20)	2.19	4.27	2.52	(1.83)	2.28	5.29

Notes:

- The above is an extract of the detailed format of Financial Results for the Quarter ended on June 30, 2025 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the un-audited Financial Results are available on the Company's website, www.ganeshbenzoplast.com and on Stock Exchange website, www.bse.co.in
- The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 11th August, 2025.

Place: Mumbai
Date: August 11, 2025

By Order of the Board
Ganesh BenzoPlast Limited
Sd/-
(Rishi Patel)
Chairman & Managing Director
(DIN: 0901627)